

બ્રામ્પટનની શિયાળુ ઋતુને લગતી કામગીરીઓ

અહીં બરફ પડે ત્યારે શહેરમાં શું કામ થાય છે તેને લગતી માહિતી આપી છે:

- ✓ સૌથી પહેલા, કર્મચારીઓ મુખ્ય રસ્તાઓ પર મીઠું નાખે છે અને બરફ હટાવે છે. આ મુખ્ય રસ્તાઓ છે જેની પર ભારે ટ્રાફિક રહેતો હોય છે, આ રસ્તાઓ બ્રામ્પટન ટ્રાન્ઝિટ/બસ રૂટ પર હોય છે, અથવા તેના પર પીલ સેપરેટ કે પબ્લિક સ્કૂલ હોય છે.
- ✓ એક વખત પ્રાઈમરી રોડ્સ સાફ કરવામાં આવે એટલે, કર્મચારીઓ રહેવાસી માર્ગો પર મીઠું નાખવાનું કામ શરૂ કરે છે. આ તમારા પાડોશની સ્ટ્રીટ્સ છે. રહેવાસી રસ્તાઓ પરથી:
 - બરફ માત્ર ત્યારે હટાવવામાં આવે છે જ્યારે એક જ તોફાનમાં ઓછામાં ઓછો 7.5 સે.મી. (3 ઈંચ) જેટલો બરફ પડ્યો હોય. જે હોકી પકના વ્યાસ જેટલો, અથવા ક્રિકેટ બૉલ કરતા સહેજ મોટો હોય.
 - મુખ્ય રસ્તાઓની જેમ લાટી દેખીતી કરવા બરફ હટાવવામાં આવતો નથી. સ્ટ્રીટ પરથી બરફ હટાવ્યા પછી પણ, થોડોક બરફ જમીન પર રહે તે સામાન્ય બાબત છે.
- ✓ શહેરી કર્મચારીઓ ઉદ્યાનોમાં પગદંડીઓ, તેમજ એ સાઈડવૉક્સ (ફૂટપાથ) પરથી પણ બરફ હટાવીને કાંકરી નાખે છે જે:
 - પ્રાઈમરી રોડ પર હોય
 - બ્રામ્પટન ટ્રાન્ઝિટ/બસ રૂટ પર હોય
 - શહેરના ઉદ્યાનની આગળ અથવા તમારી મિલકત પાછળની કોઈ સગવડમાં હોય
 - કર્બ-ફ્રેસ (ફૂટપાથ અને રસ્તા વચ્ચેની કિનારી) (સાઈડવૉક અને રસ્તા વચ્ચે ઘાસની પટ્ટી નહીં)

બીજા બધાં સાઈડવૉક્સ જાળવણીની જવાબદારી મિલકત માલિકની રહે છે

કર્મચારીઓનું લક્ષ્ય તમામ રસ્તાઓ, સાઈડવૉક્સ અને પગદંડીઓ હિમવર્ષા પૂરી થયાના 24 કલાકમાં જાળવવાનું હોય છે. તેમાં વધારે સમય લાગી શકે જો હવામાન પરિસ્થિતિઓ ગંભીર બને.

એક રહેવાસી તરીકે, અહીં તમે આ રીતે તફાવત ઊભો કરી શકો છો:

- ✓ હિમવર્ષા થયા પછીના દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં તમારા ઘરની સામે અને બાજુનો સાઈડવૉક સાફ કરવો.
- ✓ તમારી મિલકતમાંથી બરફને પાવડાથી રસ્તો કે સાઈડવૉક પર ફેંકશો નહીં.
- ✓ ક્યારે આપવાના દિવસે, તમારા ડ્રાઈવવેની નીચેની તરફ અથવા કર્બ (ફૂટપાથ અને રસ્તા વચ્ચેની કિનારી) પાછળની પટ્ટી પર તમારા કાર્ટર્સ માટેની જગ્યા ચોખ્ખી રાખો. તેને સાઈડવૉક કે રસ્તા પર રાખશો નહીં.
- ✓ હિમવર્ષા થાય ત્યારે, રસ્તા પર મીઠું નાખવાની અને બરફ હટાવવાની કામગીરી થતા સુધી રસ્તા પર કાર પાર્ક કરશો નહીં. રસ્તા પર કાર પાર્ક કરેલી હોય ત્યારે કર્મચારીઓ યોગ્ય રીતે જાળવણી કરી શકતા નથી.

સંપર્કમાં રહો!

- ✓ વેબસાઈટ www.brampton.ca/snow 24/7 બરફ સાફ કરવાને લગતી અદ્યતન માહિતી સહિત, શિયાળુ માહિતી મેળવવા જુઓ.
- ✓ Twitter પર @CityBrampton ને અનુસરો અને Facebook પર City of Brampton ને લાઈક કરો.